

Visit of External Affairs Minister Dr S. Jaishankar to Tajikistan (March 30-31, 2021)

March 26, 2021

વિદેશમંત્રી ડો. એસ. જયશંકરની તાજિકિસ્તાન મુલાકાત (માર્ચ 30-31, 2021)

માર્ચ 26, 2021

1. તાજિકિસ્તાનના વિદેશમંત્રી મહામહિમ સિરોજિદીન મુહરીદીનના આમંત્રણને માન આપીને વિદેશમંત્રી ડો. એસ. જયશંકર 30-31 માર્ચ, 2021 દરમિયાન તાજિકિસ્તાનની સત્તાવાર મુલાકાત લેશે.
2. આ મુલાકાત દરમિયાન વિદેશમંત્રી પોતાના તાજિકિસ્તાનના સહયોગી સાથે દ્વિપક્ષીય સંબંધો તથા પરસ્પર હિતના પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર ચર્ચા કરશે. તેઓ રિપબ્લિક ઓફ તાજિકિસ્તાનના પ્રમુખ મહામહિમ ઇમોમાલી રહમનની મુલાકાત લેશે. તેઓ તાજિકિસ્તાનના મંત્રીઓ અને મહાનુભવોને પણ મળે તેવી શક્યતા છે.
3. વિદેશમંત્રીએ અગાઉ જૂન 2019માં કોન્ફરન્સ ઓન ઇન્ટરેક્શન એન્ડ કોન્ફીડન્સ બિલ્ડિંગ મેઝર્સ ઇન એશિયા અંગે 5મી શિખર મંત્રણામાં ભાગ લેવા દુશામ્બેની મુલાકાત લીધી હતી. આ મુલાકાત બંને દેશો વચ્ચે સમયાંતરે ઉચ્ચ સ્તરે થતી વાતચીતના ભાગરૂપે છે જેનાથી ભારત અને તાજિકિસ્તાન વચ્ચે નિકટની વ્યૂહાત્મક ભાગીદારી વધુ મજબૂત બનશે.
4. વિદેશમંત્રી 30 માર્ચ 2021ના રોજ અફઘાનિસ્તાન અને તાજિકિસ્તાનના વિદેશમંત્રીઓના સંયુક્ત આમંત્રણ પર અફઘાનિસ્તાન અંગે હાર્ટ ઓફ એશિયા-ઇસ્તંબુલ પ્રોસેસ (એચઓએ-આઇપી)ની 9મી મિનિસ્ટરિયલ કોન્ફરન્સમાં ભાગ લેશે. આ દરમિયાન તેઓ તેમાં ભાગ લઈ રહેલા અન્ય દેશોના નેતાઓને પણ મળે તેવી અપેક્ષા છે.
5. એચઓએ-આઇપી હેઠળ વ્યાપાર, વાણિજ્ય અને રોકાણ માટે કોન્ફીડન્સ બિલ્ડિંગ મેઝર્સ (સીબીએમ)ના અગ્રણી દેશ હોવાના નાતે ભારતે અફઘાનિસ્તાનનું આ પ્રદેશમાં આર્થિક સંકલન વધે તે માટે પ્રાદેશિક જોડાણને મજબૂત બનાવવા સતત પ્રયાસ કર્યા છે. ભારત અને અફઘાનિસ્તાનના

શહેરો વચ્ચે એક ખાસ એર ફ્રેઇટ કોરિડોર અને ઇરાનમાં છાબહર બંદર શરૂ થવું એ આ દિશામાં પગલાં છે.

6. અફઘાનિસ્તાનમાં શાંતિ, સમૃદ્ધિ અને સ્થિરતાના મહત્ત્વના હિસ્સેદાર તરીકે ભારતે અફઘાનિસ્તાનમાં આંતરરાષ્ટ્રીય પ્રક્રિયામાં રચનાત્મક ભૂમિકા ભજવી છે. ભારતે અફઘાનિસ્તાન અંગે પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય હિસ્સેદારોને જોડ્યા છે. આ મુલાકાતથી મધ્ય એશિયાના દેશોમાં આપણી પહોંચ વધશે જેમાં અફઘાનિસ્તાન પર ખાસ ફોકસ રહેશે.

નવી દિલ્હી

માર્ચ 26, 2021

DISCLAIMER: This is an approximate translation. The original is available in English on MEA's website and may be referred to as the official press release.